

GUJARAT UNIVERSITY



નં.: પરીક્ષા/૪-અ/એનરોલમેન્ટ/૮૮૨૮૨૮/૨૦૨૦
ગુજરાત યુનિવર્સિટી કાર્યાલય,
નવરંગપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૮.

તારીખ : ૦૫-૧૧-૨૦૨૦

પરિપત્ર ક્રમાંક : ૧૧૨

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, બી.બી.એ. અને બી.સી.એ. લો તથા એજ્યુકેશન કોલેજોના આચાર્યોને જણાવવાનું કે, આ યુનિવર્સિટીના ઓર્ડી. ૬૯ની જોગવાઈ મુજબ કોઈ પણ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ કરવાનું થાય છે. હાલમાં આપની કોલેજ/સંસ્થામાં સેમેસ્ટર ૩ અને ૫ માં અન્ય યુનિવર્સિટીમાંથી પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ ફોર્મ ભરાવીને, જરૂરી બીડાણો લગાવી, નિયત પત્રક અને ફી કોલેજોએ યુનિવર્સિટી કાર્યાલયમાં તારીખ ૧૧-૧૧-૨૦૨૦ સુધીમાં જમા કરાવવા જણાવવામાં આવે છે. સેમેસ્ટર ૧ વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ માટે હવે પછી પરિપત્ર વેબસાઈટ પર મુકવામાં આવશે જેની ખાસ નોંધ લેવી.

સેમેસ્ટર ૩ અને ૫ એનરોલમેન્ટ ફોર્મ યુનિવર્સિટી કાર્યાલયમાં જમા કરાવવા માટે

મોકલતા અગાઉ નીચેની સૂચનાઓનું ચુસ્ત રીતે પાલન કરવા વિનંતી છે.

૧ : ગુજરાત યુનિવર્સિટીની ઉપરોક્ત દર્શાવેલ તમામ કોલેજો માટે એનરોલમેન્ટ ફોર્મની કીમત રૂ. ૨૫/- અને એનરોલમેન્ટ ફી રૂ. ૧૦૦/- રાખવામાં આવેલ છે. ચાલુ શૈક્ષણિક વર્ષે દરેક ફેકલ્ટીના અલગ અલગ ફોર્મ નિયત કરવામાં આવેલ છે. જે <http://efespgreg.gujaratuniversity.ac.in> ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે.

૨ : સદરહુ વિદ્યાર્થી માટે ભરવાના (BLANK) એનરોલમેન્ટ ફોર્મ વેબસાઈટ પરથી મેળવી શકાશે.

૩: વિદ્યાર્થીના એનરોલમેન્ટ ફોર્મ સાથે PEC (પ્રોવિઝનલ એલીજબીલીટી સર્ટીફિકેટ) અને ગુણપત્રકોની નકલ ખાસ બીડવી.

૪: સેમેસ્ટર ૩ અને ૫ માટે ઓનલાઈન જનરેટ થયેલી યાદી અને સંપૂર્ણ વિગતો સાથેનું ફોર્મ કોલેજના સહી સિક્કા સાથે નિયત સમય મર્યાદામાં કાર્યાલય પર જમા કરાવવાનું રહેશે.

૫: એનરોલમેન્ટ ફી કોસ ડીમાન્ડ ડ્રાફ્ટ/ચેક (ચેક રીટર્ન થયે રૂ.૨૦૦૦/- દંડ કરવામાં આવશે) “કુલસચિવશ્રી” ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ૩૮૦૦૦૮ ના નામનો કઢાવીને મોકલી આપવાનો રહેશે. ડીમાન્ડ ડ્રાફ્ટ પૂરી રકમનો કઢાવવાનો રહેશે.(DD CTS કોડવાળો હોવો જરૂરી છે.)

૬: વાર્ષિક પદ્ધતિમાંથી પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે પણ ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ગુણપત્રકો સાથે ફોર્મ કાર્યાલય પર જમા કરવાનું રહેશે.

૭: આ કાર્યાલયના તા: ૯-૧૨-૨૦૧૬ના પત્રાંક:એકે/૩૫૫૮૫/૨૦૧૬ના સંદર્ભમાં જણાવવાનુંકે , સેલ્ફ ફાઈનાન્સ કોલેજોએ ડેવલોપમેન્ટ ફી એનરોલમેન્ટ ફી સાથે જ જમા કરાવવાની થાય છે. આથી એનરોલમેન્ટ ફોર્મ ફી સાથે ડેવલોપમેન્ટ ફી અંગે અલગથી ફોરવર્ડિંગ પત્ર અને તે રકમનો ડ્રાફ્ટ લાવવાનો રહેશે. આ ડેવલોપમેન્ટ ફી એકેડેમિક વિભાગમાં જમા કરાવ્યાની પાવતી બતાવ્યા બાદ જ પરીક્ષા વિભાગ દ્વારા એનરોલમેન્ટ ફી સ્વીકારવામાં આવશે. ડેવલોપમેન્ટ ફી વિના એનરોલમેન્ટ ફી સ્વીકારવામાં આવશે નહીં. જેની ખાસ નોંધ લેશો.

(નોંધ: એનરોલમેન્ટ ફોર્મ સાથે જરૂરી વિગતો (PEC અને/અથવા FEC ગુણપત્રકો વગેરે વગેરે) જમા કરવામાં થયેલી ચૂકના કારણે વિદ્યાર્થીઓના પ્રવેશ અને પરિણામ રદ કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી કોલેજની રેહશે)

કુલસચિવ

પ્રતિ,

૧: ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, બી.બી.એ. અને બી.સી.એ. લો તથા એજ્યુકેશન કોલેજોના આચાર્યશ્રીઓ/અધ્યક્ષશ્રીઓ.

૨: પૂછપરછ વિભાગ(ત્રણ નકલ)

૩: ચીફ એકાઉન્ટસ ઓફિસર, ડિસાબ વિભાગ, ગુજરાત યુનિવર્સિટી.